

મત આપવાના 3 માર્ગ

વહેલા મત આપો: 10/17 થી 11/4

ગેરહાજર મત આપો: બેલોટ 11/7 સુધીમાં મળી જ જવું જોઈએ.

મતદાન ના દિવસે : 11/8

હં ક્યાં મત આપું?

તમે તમારું મત આપવાનું સ્થળ પર ઓનલાઇન તપાસી શકો છો. www.mvp.sos.ga.gov

મતદાન ક્યારે શરૂ થાય છે?

મતદાન સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો તમે કતાર માં હોવ અથવા તમે મત આપવાના સ્થળ માં હોવ તો મત આપવાનો સમય પૂરો થાય ત્યારે પણ તમને મત આપવાનો અધિકાર છે.

શું મત આપતી વખતે મારે માટું ઓળખપત્ર બતાવવાની જરૂર છે ?

હા, જ્યોર્જિયા નિયમ પ્રમાણે બેલોટ લેતા પહેલા બધાં મતદાતાઓએ ફોટોવાળું ઓળખપત્ર બતાવવું જરૂરી છે. સ્વીકાર્ય ID સ્વરૂપોમાં

1. એક જ્યોર્જિયા ડ્રાયવર્સ લાયસન્સ, જો સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તેમ છતાં, અથવા એક જ્યોર્જિયા મતદાર ID કાર્ડ;
2. રાજ્ય અથવા ફેડરલ સરકાર દ્વારા આપેલ ઓળખપત્ર, જાહેર યુનિવર્સિટી, કોલેજ, અથવા જ્યોર્જિયા ટેકનિકલ શાળા સહિત (ફોટો સાથે) એક માન્ય ID કાર્ડ;
3. અમેરિકી લશ્કરી ફોટા સાથે એક માન્ય ID કાર્ડ
4. ફેડરલ સરકાર અથવા જ્યોર્જિયા સરકારના કોઈ પણ વિભાગ દ્વારા આપેલ, ફોટા સાથે, એક માન્ય કર્મચારી ID કાર્ડ;
5. ફોટો સાથે એક માન્ય આદિવાસી ID કાર્ડ
6. એક માન્ય અમેરિકી પાસપોર્ટ.

શું બેલોટ ઇંગ્લિશ સિવાય કોઈ અન્ય ભાષા માં ઉપલબ્ધ હશે?

ના. જ્યોર્જિયા ચૂંટણી સામગ્રી માત્ર અંગ્રેજી માં ઉપલબ્ધ છે. જો કે, તમે તમારી સાથે ચૂંટણી સમયે એક દુભાષિયો લાવી શકો અથવા, તમને મતદાન કાર્યકર સહિત કોઈપણ ને ભાષા સહાય માટે મેળવી શકવાનો અધિકાર છે. વ્યક્તિ જે તમને મદદ કરે છે તે તમને નોકરી આપનારા, તમારા નોકરીદાતાના એક એજન્ટ, અથવા તમારા શ્રમ સંઘના એક અધિકારી અથવા પ્રતિનિધિ ન હોઈ શકે.

વધુ જાણકારી:

Georgia State Elections Division
404-656-2871 or <http://sos.georgia.gov/elections/>
US Department of Justice Voting Section:
1-800-253-3931

જો મને સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા પત્ર મળે કે જેમાં વધારાની માહિતી માંગી હોય તો મારે શું કરવું જોઈએ?

- જો તમને એક પત્ર મળે કે જે કહેતો હોય કે તમારી એપ્લિકેશનમાં આપેલ માહિતી ડ્રાઇવર સેવાઓના વિભાગ (ડી.ડી.એસ.) કે સામાજિક સુરક્ષાના વહીવટી વિભાગની ફાઇલો સાથે મળતી નથી તો તમે ચૂંટણીના દિવસે કે એના પહેલા ડાબી બાજુએ રહેલી યાદી પ્રમાણે કોઈપણ એક સ્વીકાર્ય આઈ.ડી બતાવીને વોટ આપી શકો છો.
- જો તમે યુ.એસના એક નાગરિક હોવ પણ તમને ડી.ડી.એસનો એક પત્ર મળે કે જે એમ સૂચવે કે તમે યુ.એસના નાગરિક નથી તો તમે ચૂંટણીના સમયે કે તેના પહેલા ચૂંટણી અધિકારીને તમારા નાગરિકત્વની સાબિતી આપીને વોટ આપી શકો છો.
- જો તમને એક પત્ર મળ્યો હોય કે જે કહેતો હોય કે તમારી રજીસ્ટ્રેશન એપ્લિકેશન અધુરી છે, તો તમારે વોટ આપતા પહેલા તમારી બાકી રહેલી માહિતી સ્થાનિક રજિસ્ટ્રાર પાસે જમા કરાવવાની રહેશે.
- જો તમે અઢાર વર્ષના થાવ એની પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે, તો તમે જ્યારે અઢાર વર્ષના થશો ત્યારે સત્તાવારરીતે આપોઆપ રજીસ્ટર થઈ જશો.

જો માટું નામ મતદાતાની સૂચીમાં ના હોય તો શું કરવું?

તમારું નામ મતદાર યાદીમાં નથી અને તમે પુષ્ટિ કરી છે કે તમે યોગ્ય મતદાન સ્થળ પર છો તો, એક કામચલાઉ મતદાન માટે મતદાન કાર્યકરને પૂછો. તમને એક કામચલાઉ મતદાન કરવાનો અધિકાર છે.

જો કોઈ મને ડરાવવા અથવા પરેશાન કરવા માટે પ્રયાસ કરે છે તો શું કરવું?

મતદાન સ્થળ પર મુખ્ય અધિકારીને ઘટનાની જાણ કરો. જો મુખ્ય અધિકારી સમસ્યા છે, તો એક મતદાન નોંધકને કહેવું, તમારા કાઉન્ટી ચૂંટણી ઓફિસને કોલ કરો, અથવા ચૂંટણી હોટલાઇન નંબર પર કોલ કરો જે આ કાર્ડને અંતે આપેલ છે.

સમસ્યાઓ? કોલ

Asian Americans Advancing Justice - Atlanta
470-765-VOTE (8683)
ADVANCINGJUSTICE-ATLANTA.ORG

